

# COVIDSafe ઓસ્ટ્રેલિયા તરફ આગળ વધવાની યોજના

## COVIDSAFE

રાજ્યો અને પ્રદેશો સ્થાનિક પરિસ્થિતિઓ અનુસાર જુદા-જુદા સમયે આગળ વધશે  
રાષ્ટ્રીય મંત્રીમંડળ દર ત્રણ અઠવાડિયે જે તે પગલાંની પ્રગતિની સમીક્ષા કરશે

### પગલું ૧

શારીરિક અંતર જાળવી રાખી અને સ્વચ્છતા સાથે COVID થી સુરક્ષિત રહી પુનઃખોલવાની શરૂઆત થશે

તમારા ઘરે વધુમાં વધુ ૫ મુલાકાતીઓ આવી શકે  
ઘરની બહાર વધુમાં વધુ ૧૦ લોકો ભેગા થઈ શકે  
જો તમારા અને તમારા નોકરીદાતા માટે શક્ય હોય તો ઘરેથી કામ કરો

પુસ્તકાલયો, સમુદાય કેન્દ્રો, મેદાનો અને શિબિરો શરૂ થશે

ઓસ્ટ્રેલિયાના લોકો વધુ કરી શકશે:

- ખરીદી
- ભોજનાલયો અને કાફે
- ઘરનું વેચાણ અને હરાજી
- સ્થાનિક મેદાનો
- ખુલ્લામાં થતી શિબિરો
- સ્થાનિક અને પ્રાદેશિક મુસાફરી

### પગલું ૨

શારીરિક અંતર જાળવી રાખીને અને સ્વચ્છતા સાથે મોટાભાગના ધંધા ફરીથી ખૂલશે

ઘરની બહાર વધુમાં વધુ ૨૦ લોકો ભેગા થઈ શકે  
જો તમારા અને તમારા નોકરીદાતા માટે શક્ય હોય તો ઘરેથી કામ કરો  
ઓસ્ટ્રેલિયાના લોકો વધુમાં વધુ ૨૦ વ્યક્તિઓના જૂથમાં હજુ વધુ કરી શકશે :

- વ્યાયામશાળા
- સૌંદર્ય ચિકિત્સકો
- ચલચિત્રો, નાટકો અથવા મનોરંજનના ઉદ્યાનો
- પ્રદર્શનો અને સંગ્રહાલયો
- કેટલીક આંતરરાજ્ય મુસાફરી

અમુક સંજોગોમાં રાજ્યો અને પ્રદેશો મોટી સંખ્યાની મંજૂરી આપી શકે છે

### પગલું ૩

શારીરિક અંતર જાળવી રાખીને અને સ્વચ્છતા સાથે ઓસ્ટ્રેલિયાના તમામ લોકો કામે પાછા ફરશે

વધુમાં વધુ ૧૦૦ માણસો ભેગા થઈ શકે છે  
કાર્યસ્થળ પર પાછા ફરો

ક્રોસ-તાસ્માન, પેસિફિક ટાપુ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની મુસાફરી પર વિચાર કરો

વધુમાં વધુ ૧૦૦ વ્યક્તિઓના જૂથમાં ઓસ્ટ્રેલિયાનાં લોકો હજુ વધુ કરી શકશે:

- ફૂડ કોર્ટ
- બાષ્પસ્નાન અને સ્નાનાગૃહો
- બધી આંતરરાજ્ય મુસાફરી

અમુક સંજોગોમાં રાજ્યો અને પ્રદેશો મોટી સંખ્યાની મંજૂરી આપી શકે છે

આને સફળ બનાવવા માટે ઓસ્ટ્રેલિયાના લોકો શું કરી શકે છે

COVIDSAFE

વ્યક્તિગત જવાબદારીઓ



૧.૫ મીટરનું  
શારીરિક અંતર  
જાળવવું



હાથની  
સ્વચ્છતા  
જાળવવી



શ્વસનમાં  
સ્વચ્છતા  
જાળવવી



માંદા હોય, તો  
ઘરે રહવું



COVIDSafe એપ  
ફોનમાં નાંખી લેવી

આરોગ્યના પાયા



વસ્તી આધારિત  
ચકાસણી



પુષ્ટિ થયેલ કિસ્સાઓના સંપર્કમાં  
આવેલાઓને શોધવાની ક્ષમતામાં  
વધારો



સ્થાનિક આરોગ્ય  
વ્યવસ્થાનો પ્રતિભાવ

નબળા લોકોનું રક્ષણ કરવું



નબળા લોકોએ શક્ય હોય ત્યાં ઘરે જ રહેવું જોઈએ

અંતરિયાળ વિસ્તારો અને આદિવાસી અને ટોરસ સ્ટ્રેટ ટાપુના રહેવાસીઓની વસ્તી તરફ મુસાફરી પર પ્રતિબંધ  
વૃદ્ધ સંભાળ નિયંત્રણો અને કુટુંબ અને સમાજિક સંપર્કની જરૂરિયાત વચ્ચે સંતુલન